



અખબારી યાદી

તા. ૧૪/૦૩/૨૦૨૦

ફીટ ઈન્ડિયા મુવમેન્ટ અંતર્ગત સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં રહેલ રમતગમતની તમામ સુવિધાઓનો યોગ્ય ઉપયોગ થાય તે માટે યુનિવર્સિટી દ્વારા પ્લેસમેન્ટ / કરાર આધારિત આઉટસોર્સિંગ થી ટેમ્પરરી સ્ટાફની સેવા લેવાની વ્યવસ્થા શરૂ કરવામાં આવેલ છે. જેમાં નીચે પ્રમાણેની રમતોના નિયમિત તાલીમ કાર્યક્રમોનું આયોજન આગામી એપ્રિલ માસથી વિવિધ બેચમાં શરૂ કરવામાં આવનાર છે. જે શાળા કે કોલેજો ના વિદ્યાર્થીઓએ નિયમિત તાલીમ કાર્યક્રમોમાં ભાગ લેવાની તૈયારી હોય તેઓએ યુનિવર્સિટીની વેબસાઇટ પરથી ફોર્મ ડાઉન લોડ કરવા અથવા સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સવારે 7:00 થી 9:00 સાંજે 4:00 થી 6:00 દરમિયાન અથવા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના શારીરિક શિક્ષણ વિભાગ માં ઓફિસ સમય દરમિયાન મેળવી લેવાના રહેશે. વધુ વિગતો જેમકે રમતોના નામ બેચનો સમય ફોર્મ, ફીની વિગતો અને શરતો વિગેરેની માહિતી શ્રી જયેશ ગ્રાંભડિયા (મો.૯૭૨૩૨ ૩૧૯૯૮) અને શ્રી જીગ્નેશ નિમાવત (મો.૯૯૧૩૭ ૪૧૭૧૭)ના મોબાઈલ ફોન થી મેળવી શકાશે.

ફોર્મ ડાઉનલોડ કરવા માટેનો પાથ: <https://saurashtrauniversity.edu/university/administrative-sections/physical-education-section/>

રમતનું નામ	બેચનો સમય સવારે	બેચનો સમય સાંજે
બાસ્કેટબોલ	૦૭:૦૦ થી ૦૮:૦૦ અને ૦૮:૦૦ થી ૦૯:૦૦	૦૪:૩૦ થી ૦૫:૩૦ અને ૦૫:૩૦ થી ૦૬:૩૦
સ્વીમીંગ / વોટરપોલો	૦૭:૦૦ થી ૦૮:૦૦, ૦૮:૦૦ થી ૦૯:૦૦ અને ૦૯:૦૦ થી ૧૦:૦૦ (ભાઈઓ માટે)	૦૪:૦૦ થી ૦૫:૦૦ અને ૦૫:૦૦ થી ૦૬:૦૦ (બહેનો માટે)
ક્રિકેટ	૦૭:૦૦ થી ૦૮:૦૦ અને ૦૮:૦૦ થી ૦૯:૦૦	૦૪:૩૦ થી ૦૫:૩૦ અને ૦૫:૩૦ થી ૦૬:૩૦
હેન્ડબોલ	૦૭:૦૦ થી ૦૮:૦૦ અને ૦૮:૦૦ થી ૦૯:૦૦	૦૪:૩૦ થી ૦૫:૩૦ અને ૦૫:૩૦ થી ૦૬:૩૦
બેડમિન્ટન	૦૭:૦૦ થી ૦૮:૦૦ અને ૦૮:૦૦ થી ૦૯:૦૦	
જીમ્નાસ્ટીક / એરોબિક્સ / યોગ	૦૬:૦૦ થી ૭:૦૦:	૦૬:૦૦ થી ૭:૦૦:
વોલીબોલ	૦૭:૦૦ થી ૦૮:૦૦ અને ૦૮:૦૦ થી ૦૯:૦૦	૦૪:૩૦ થી ૦૫:૩૦ અને ૦૫:૩૦ થી ૦૬:૩૦
10મી. રાઇફલશૂટિંગ	૦૭:૦૦ થી ૦૮:૦૦ અને ૦૮:૦૦ થી ૦૯:૦૦	૦૪:૩૦ થી ૦૫:૩૦ અને ૦૫:૩૦ થી ૦૬:૩૦
કુટબોલ	૦૭:૦૦ થી ૦૮:૦૦ અને ૦૮:૦૦ થી ૦૯:૦૦	૦૪:૩૦ થી ૦૫:૩૦ અને ૦૫:૩૦ થી ૦૬:૩૦
હોકી	૦૭:૦૦ થી ૦૮:૦૦ અને ૦૮:૦૦ થી ૦૯:૦૦	૦૪:૩૦ થી ૦૫:૩૦ અને ૦૫:૩૦ થી ૦૬:૩૦
ટેબલ ટેનિસ	૦૭:૦૦ થી ૦૮:૦૦ અને ૦૮:૦૦ થી ૦૯:૦૦	૦૪:૩૦ થી ૦૫:૩૦ અને ૦૫:૩૦ થી ૦૬:૩૦
ટેનિસ	૦૭:૦૦ થી ૦૮:૦૦ અને ૦૮:૦૦ થી ૦૯:૦૦	૦૪:૩૦ થી ૦૫:૩૦ અને ૦૫:૩૦ થી ૦૬:૩૦
એથલેટિક્સ / સુસ્થિતિ કસરતો	૦૭:૦૦ થી ૦૮:૦૦ અને ૦૮:૦૦ થી ૦૯:૦૦	૦૪:૩૦ થી ૦૫:૩૦ અને ૦૫:૩૦ થી ૦૬:૩૦